

B.A. Semester - 2 (CBCS) Examination
March/April - 2024 (As Per Syllabus Year-2016)
ECONOMICS : P3 PRINCIPLES OF ECONOMICS-2 (CORE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતરસંબંધો આકૃતિ દ્વારા સ્પષ્ટ કરો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૧ પેઢી અને ઉદ્યોગ વિકાસના લાભોની ચર્ચા કરો.
- પ્રશ્ન.૨ ઘટતા મળતરનો નિયમ સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૨ સ્થિરખર્ચ અને અસ્થિર ખર્ચના ખ્યાલો ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો.
- પ્રશ્ન.૩ વહેંચણીનો સિમાંત ઉત્પાદકતાનો સિધ્ધાંત સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૩ “નફો જોખમ વહોરવાનું નહિ પરંતુ અનિશ્ચિતતા વહોરવાનું વળતર છે.” – ચર્ચા કરો.
- પ્રશ્ન.૪ ભાડાનો આધુનિક સિધ્ધાંત સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૪ “નફો નવપ્રવર્તનનું પરિણામ છે.” – ચર્ચા કરો.
- પ્રશ્ન.૫ ટૂંકનોંધ લખો. (કોઇપણ બે) (૧૪)
- 1) વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ
 - 2) આભાસી ભાડું
 - 3) કાચો નફો અને શુદ્ધ નફા વચ્ચેનો તફાવત
 - 4) ઘટતા મળતરના નિયમની ઉપયોગીતા

ENGLISH VERSION

- Que.1 Clarify the interrelationships between average cost and marginal cost with the help by diagram. (14)
 OR
- Que.1 Discuss the advantage of expansion size of firm and industry.
- Que.2 Explain the law of diminishing returns. (14)
 OR
- Que.2 Explain the concept of fixed cost and variable cost with the help of illustration and figure.
- Que.3 Explain the marginal productivity theory of distribution. (14)
 OR
- Que.3 “profit is not reward for bearing of risks but reward for bearing of uncertainty discuss.”
- Que.4 Explain the modern theory of rent. (14)
 OR
- Que.4 “profit is a result of innovation”- discuss.
- Que.5 Write a short note: (any two) (14)
- 1) The concept of alternative cost.
 - 2) Quasi – rent
 - 3) Difference between gross profit & net profit.
 - 4) Usefulness of the law of diminishing return.
